#### Regd. Office :-

330, TRIVIA Complex, Natubhai Circle, Racecourse, Vadodara – 390007, Gujarat, INDIA

Phone : +91 265 2988903 / 2984803 Website : www.chemcrux.com Email : girishshah@chemcrux.com





10<sup>th</sup> November 2023

To.

## Corporate Relations Department BSE LIMITED,

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400 001

Dear Sir/Madam,

Subject: Newspaper Publication of Standalone Unaudited Financial Results for the quarter and

half year ended 30th September 2023

**Ref:** BSE Scrip ID: **CHEMCRUX** BSE Scrip Code: **540395** 

Pursuant to Regulation 30 & 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper publication of Standalone Unaudited Financial Results of the Company for the quarter and half year ended 30<sup>th</sup> September 2023 published in Financial Express (English and Gujarati Edition) on Friday, 10<sup>th</sup> November 2023.

Kindly take the above on your record.

Yours faithfully,

For CHEMCRUX ENTERPRISES LIMITED

DIPIKA KUMAR Digitally signed by DIPIKA KUMAR RAJPAL

RAJPAL

Date: 2023.11.10 14:52:50 +05'30'

Dipika Rajpal

**Company Secretary & Compliance Officer** 

**FINANCIAL EXPRESS** 

₹ In Lakh (Except per share data)

LEAD FINANCIAL SERVICES LIMITED

Regd Office: 101, Sita Ram Mansion, 718/21 Joshi Road, Karol Bagh, New Delhi-110005 CIN No.: L74140DL1993PLC053485, Ph.: 011-23549822

Web Site: www.leadfinancialservices.in E mail: lead\_financial@rediffmail.com Extract of Unaudited Financial Results for the Quarter & Half Year ended September 30, 2023

S.	Particulars	0	Quarter ended			Half Year ended		
No.		30.09.2023 (Reviewed)	30.06.2023 (Reviewed)		30.09.23 (Reviewed)	30.09.22 (Reviewed)	31.03.2023 (Audited)	
1.	Total income from operations	14.99	8.23	0.69	23.22	1.29	31.64	
2.	Net Profit/ (Loss) for the period (before tax and exceptional items)	9.77	3.91	(3.09)	13.68	(6.98)	17.89	
3.	Net Profit/ (Loss) for the period before tax (after exceptional items)	9.77	3.91	(3.09)	13.68	(6.98)	17.89	
4.	Net Profit/ (Loss) for the period after tax (after exceptional items)	7.17	2.93	(2.35)	10.10	(5.27)	14.30	
5.	Total Comprehensive Income for the period [Comprising Profit! (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	7.28	3.22	(2.20)	10.50	(5.36)	14.07	
6.	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	330.00	330.00	330.00	330.00	330.00	330.00	
7.	Other Equity				152		236.13	
8.	Earnings Per Share (of Rs. 10/- each) (Not annualised) Basic: Diluted:	0.22 0.22	0.09	(0.07) (0.07)	0.31 0.31	(0.16) (0.16)	0.43 0.43	

the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015 (as amended). The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange Website i.e. www.bseindia.com and on Company's website i.e. www.leadfinancialservices.in For and on behalf of the Board

Place: New Delhi Date: November 9, 2023

P.C Bindal (Chairman)

For Lead Financial Services Ltd.



### CHEMCRUX ENTERPRISES LIMITED

CIN: L01110GJ1996PLC029329 Regd. Off.: 330, TRIVIA Complex, Natubhai Circle, Racecourse, Vadodara-390007 Email: girishshah@chemcrux.com Ph.: 0265-2984803/2988903

Website: www.chemcrux.com

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER 2023 (Rs. in lakhs except EPS)

Sr.	Particulars	C	uarter End	ed	Half Yea	Year Ended	
No.		30/09/2023 (Unaudited)	30/06/2023 (Unaudited)	30/09/2022 (Unaudited)	30/09/2023 (Unaudited)	30/09/2022 (Unaudited)	31/03/2023 (Audited)
1.	Total income from operations (net)	1607.67	2,246.97	2,806.48	3854.63	5521.05	9620.45
2.	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items)	178.31	316.11	550.97	494.40	1,067.75	1,964.79
3.	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items)	178.31	316.11	550.97	494.40	1,067.75	1,964.79
4.	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	124.44	232.62	402.57	357.05	785.62	1,435.81
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss)for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	119.48	258.79	408.61	378.27	794.10	1,468.42
6.	Paid up Equity Share Capital (Face Value Rs 10 each)	1480.88	1480.88	1480.88	1480.88	1480.88	1480.88
7.	Other equity excluding revaluation reserve	1 - 1	-			-	5159.70
8.	Earnings per share (of Rs. 10/- each) 1. Basic (in Rs.) 2. Diluted (in Rs.)	0.84 0.84	1.57 1.57	2.72 2.72	2.41 2.41	5.31 5.31	9.70 9.70

#### Notes:

Place: Vadodara

1. The above unaudited standalone financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 09th November 2023. The figures for the quarter and half year ended 30th September 2023 have been subjected to limited review by the statutory auditors.

2. The figures of the previous years have been regrouped and reclassified wherever necessary. 3. The above is an extract of the detailed format of Quarterly and Half Yearly Financial Results filed with the Stock Exchange (BSE)

under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Half Yearly Financial Results is available on the Stock Exchange website at www.bseindia.com & company's website at www.chemcrux.com.

By Order of the Board For CHEMCRUX ENTERPRISES LIMITED Girishkumar Shah (Whole Time Director) (DIN:00469291) Date: 09th November, 2023

### **CALCOM VISION LIMITED**

CIN: L92111DL1985PLC021095 Regd.Office: C-41, Defence Colony, New Delhi-110024 Website: www.calcomindia.com; Email: corp.compliance@calcomindia.com; Contact No.- 01202569761 Exracts of Unaudited Financial Results for the quarter and Half Year ended 30 September, 2023

(Rupees in lakhs, except per share data) Quarter Ended Year ended Half Year Ended 30th Sept. 30th June 30th Sept 30th Sept. 30th Sept 31st March Particulars 2023 2022 2023 2022 2023 2023 Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited 3,917.12 3,307.95 3,901.70 7,225.07 6,909.33 16,006.73 Total income from Operations Net Profit / (Loss) for the period before tax 6.01 56.86 205.55 62.87 311.67 807.54 Net Profit / (Loss) for the period 4.50 42.55 153.82 47.05 233.23 564.62 after tax Total comprehensive income/(loss) for the period / year (comprising profit for the period after tax and Other Comprehensive Income 20.52 60.71 161.57 81.23 266.36 640.53 after tax) Paid-up equity share capital (face value of Rs. 10 each, fully paid) 1,345.65 1,338.56 1,276.35 1,345.65 1,279.18 1,276.35 Reserves excluding revaluation reserve as per balance sheet 2,208.33 Earnings / (loss) Per Share (of Rs. 10 each) (\*not annualised): a. Basic (Rs.) 0.03\* 0.33 1.21 0.36\* 1.83\* 4.42

## Notes:

The above financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at the Meetings held on 8th November, 2023.

0.32

1.18\*

0.03\*

The above is an extract of the detailed format of Quarterly financial result for the quarter and half year ended 30 September 2023 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the financial results are available on the stock exchange website, www.bseindia.com and on the Company's website, www.calcomindia.com.

By order of the Board

0.35\*

Place: Greater Noida Daye: November 8, 2023

b. Diluted (Rs.)

For CALCOM VISION LIMITED CHAIRMAN & MANAGING DIRECTOR

1.78\*

4.32

## **AMIN TANNERY LIMITED**

CIN No.U19115UP2013PLC055834 Regd. Office: 15/288 C, Civil Lines, Kanpur - 208 001 (U.P); Ph. No.: +91 512 2304077, Email: share@amintannery.in, Web: www.amintannery.in

## EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE

	QUARTER AND HALF YEAR I	ENDED 30TH S	NDED 30TH SEPTEMBER, 2023					
SI. No	Particulars	Three Months ended 30.09.2023 (Unaudited)	Three Months ended 30.06.203 (Unaudited)	Three Months ended 30.09.2022 (Unaudited)	Half Year ended 30.09.2023 (Unaudited)			
1.	Total Income	1,011.56	1,406.56	1,242.29	2,418.12			
2.	Net Profit before Interest, depreciation, exceptional items and tax	73.12	85.47	80.50	158.59			
3.	Net Profit for the period before tax (before Exceptional and Extraordinary items)	9.96	14.48	9.42	24.44			
4.	Net Profit for the period before tax (after Exceptional and Extraordinary items)	9.96	14.48	9.42	24.44			
5.	Net Profit for the period after tax (after Exceptional and Extraordinary items)	7.55	10.76	6.68	18.31			
6.	Total Comprehensive Income for the period	10.52	9.23	7.40	19.75			
7.	(Face value of ₹ 1/- per share)	1,079.73	1,079.73	1,079.73	1,079.73			
8	Basic and Diluted Earnings Per Share (of ₹1/-each) ( Not Annualized *)	600000	161 GC191	2272000	EXAM.			
Ī	Before Extraordinary Items (in ₹ )	0.01	0.01	0.01	0.02			
Sec	A 40		W W W					

Notes: 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the guarter and half year ended consolidated and standalone financial results are available on the Stock Exchange websites:www.bseindia.com and on the Company's website www.amintannery.in. 2. These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of Companies Act 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules 2015 and relevant amendment thereafter. The said financial results of the Parent Company and its subsidiaries [together referred as the "Group"] have been prepared in accordance with Ind AS 110 - Consolidated financial statements".

0.01

0.01

0.01

For and on Behalf of Board of Directors **VEQARUL AMIN** Place: KANPUR Managing Director Date: 8" November, 2023 DIN: 00037469

## "IMPORTANT"

Whilst care is taken prior to

acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

# Oriental Aromatics Ltd.

Regd. Office: 133, Jehangir Building, 2nd Floor, M.G. Road, Mumbai – 400 001 CIN: L17299MH1972PLC285731 Unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September, 2023.

			Standalone	Consolidated				
Sr.No	Particulars	Quarter Ended	Half Year Ended	Quarter Ended	Quarter Ended	Half Year Ended	Quarter Ended	
		30.09.2023	30.09.2023	30.09.2022	30.09.2023 30.09.2023		30.09.2022	
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	
1.	Total Income from Operations (Net)	22,963.50	42,590.52	22,310.75	22,963.50	42,590.52	22,310.75	
2.	Net Profit for the period (before tax)	349.61	(429.03)	897.85	342.23	(449.38)	879.18	
3.	Net Profit for the period (after tax)	250.42	(343.03)	649.60	242.48	(362.16)	633.82	
4.	Total Comprehensive Income for the period	248.92	(346.03)	641.60	240.98	(365.16)	625.82	
5.	Paid-up Equity Share Capital (FV of Rs.5/- each)	1,682.68	1,682.68	1,682.68	1,682.68	1,682.68	1682.68	
6.	Earnings per Share (EPS)	_		1,3			5	
	- Basic & Diluted EPS	0.74	(1.02)	1.93	0.72	(1.08)	1.88	

Notes: 1) The above Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on November 09, 2023. The statutory auditors of the Company have reviewed the financial results for the quarter and half year ended Sept 30, 2023 in terms of Regulations 33 of SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015 and have issued their review reports with unmodified conclusion on the unaudited Consolidated and Standalone Financial Results. 2) The full format of above extract of Financial Results, together with the Report of the Statutory Auditors are available on website of the Stock Exchanges vis. www.bseindia.com & www.nseindia.com and also under "Investor Relations" link of Company's website www.orientalaromatics.com

Place: Mumbai Date: 09/11/2023 For Oriental Aromatics Ltd. Dharmil A. Bodani Chairman & Managing Director DIN: 00618333



## IRIS Business Services Limited

Reg. Off: T-231, Tower 2, 3rd Floor, International Infotech Park, Vashi - 400 703, Maharashtra, India. Tel: +91 22 67231000, Fax: +91 22 2781 4434, E-mail: cs@irisbusiness.com, Website: www.irisbusiness.com CIN: L72900MH2000PLC128943

1		Thr	ee Months En		cept per share Half Yea	r Ended	Yearly	
Sr.	Particulars	30.09.2023	30.06.2023	30.09.2022	30.09.2023	30.09.2022	31.03.2023	
No.		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
1	Total Income from Operations	2417.45	2072.98	1770.63	4490.43	3445.86	7490.34	
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and /or Extraordinary items)	165.14	116.19	68.36	281.32	150.20	520.18	
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	165.14	116.19	68.36	281.32	150.20	520.18	
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and /or Extraordinary items)	137.01	93.03	56.36	230.03	122.20	428.51	
5	Total Comprehensive Income for the period {comprising profit / (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)}	147.64	110.95	110.02	258.60	179.20	373.24	
6	Equity Share Capital	1936.12	1936.12	1930.72	1936.12	1930.72	1936.12	
7	Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of the Previous Year	-	-		- 1	-	1218.02	
8	Earnings Per Equity Share of Rs.10/- each for continui	ng and disco	ntinuing ope	rations (^ - r	ot annualise	d)		
	a. Basic (₹)	0.71^	0.48^	0.29^	1.19^	0.64^	2.22	
	b. Diluted (₹)	0.70^	0.48^	0.29^	1.18^	0.63^	2.21	
In	respect to standalone results of the Company, the amounts are as follows	:					(₹ in Lakhs)	
	Pi Pi	Thr	ee Months En	ded	Half Yea	r Ended	Yearly	
P	articulars	30.09.2023	30.06.2023	30.09.2022	30.09.2023	30.09.2022	31.03.2023	
T	atal Income from Operations	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
10	otal Income from Operations	2293.34	1959.12	1564.78	4252.45	3099.63	6875.43	

### Notes:

Profit before Tax

Profit After Tax

Total Comprehensive Income

a. The above unaudited consolidated financial results for the quarter and half year ended September 30th, 2023 were reviewed and recommended by the Audit committee of the Board and approved by the Board of Directors at its meeting held on November 8th, 2023.

147.95

121.04

131.45

107.56

84.40

103.57

57.07

45.07

103.17

255.51

205.44

235.03

- b. Based on the "management approach" as defined in Ind-AS 108 Operating Segments, the Chief Operating Decision Maker evaluates the Group's performance on three business segments namely 'Collect', 'Create' and 'Consume'.
- c. With respect to our investment in "IRIS Business Services LLC" incorporated in USA (the "Subsidiary") as at September 30, 2023 the total liabilities exceeded its total assets by ₹ 96.03 lakhs. The parent company is committed to provide necessary financial support as and when necessary. Considering the future prospect of the subsidiary and continued support of Parent company, the investment in the subsidiary is measured at cost.
- d. The above is an extract of the detailed format of Financial results for the guarter and half year ended September 30, 2023, filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the quarter and half year ended September 30, 2023, are available on stock exchange websites at www.nseindia.com and www.bseindia.com and on Company's website at www.irisbusiness.com.
- e. Corresponding previous period's figures have been regrouped and reclassified wherever necessary.

Place: Navi Mumbai Date: November 08, 2023

By order of the Board For IRIS Business Services Limited K. Balachandran Whole Time Director & CFO DIN: 00080055

128.54

100.54

164.29

455.95

367.73

310.20

SMFG India Credit Co. Ltd. (Formerly Fullerton India Credit Co. Ltd.) Registered office address: Megh Towers, 3rd Floor, Old No. 307, New No. 165, Poonamallee High Road, Maduravoyal, Chennai - 600 095, Tamil Nadu. Toll free no. 1800 103 6001 | Email: namaste@smfgindia.com Website: www.smfgindiacredit.com | CIN number: U65191TN1994PLC079235

1. Extract of financial results for the quarter and half year ended September 30, 2023.

Particulars	Quarter ended Sep 30, 2023	Quarter ended June 30, 2023	Quarter ended Sep 30, 2022	Half year ended Sep 30, 2023	Half year ended Sep 30, 2022	Year ended Mar 31, 2023
İ	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1. Total Income from Operations	1,70,427	1,57,962	1,16,900	3,28,389	2,14,929	5,02,784
2. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	24,152	12,826	25,372	36,978	37,609	89,454
3. Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	24,152	12,826	25,372	36,978	37,609	89,454
4. Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	18,056	9,671	19,029	27,727	28,096	67,014
5. Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	22,775	5,758	21,267	28,533	32,655	71,394
6. Paid-up Equity Share Capital	2,24,672	2,24,672	2,24,672	2,24,672	2,24,672	2,24,672
7. Reserves (excluding Revaluation Reserves)*	3,31,046	3,08,271	2,63,773	3,31,046	2,63,773	3,02,512
8. Securities Premium Account	1,38,722	1,38,722	1,38,722	1,38,722	1,38,722	1,38,722
9. Net Worth	5,48,525	5,26,768	4,84,013	5,48,525	4,84,013	5,20,321
10. Outstanding Debt at amortised cost	29,81,576	27,76,938	22,77,806	29,81,576	22,77,806	28,68,756
11. Debt Equity Ratio	5.4	5.3	4.7	5.4	4.7	5.5
12. Earnings Per Share (EPS) (of ₹ 10/- each) ( in ₹ )						
- Basic**	0.80	0.43	0.85	1.23	1.25	2.98
- Diluted**	0.80	0.43	0.85	1.23	1.25	2.98
13. Capital Redemption Reserve	Nil	Nil	Nil	Nil	Nil	Ni
14. Debenture Redemption Reserve^	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
15. Debt Service Coverage Ratio^^	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
16. Interest Service Coverage Ratio^^	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable

\*\*not annualised for periods other than year ended March 31, 2023 \* Includes securities Premium Account

- ^ The Company is not required to create debenture redemption reserve in terms of the Companies (Share Capital and Debenture) Rules, 2014 read with the Companies (Share Capital and Debenture) Amendments Rules, 2019
- ^^ The Company is a Non-Banking Financial Company registered under the Reserve Bank of India Act, 1934 hence these ratios are generally not applicable.

2. SMFG India Credit Company Limited (formerly Fullerton India Credit Company Limited) ('the Company') is a public limited company domiciled in India and incorporated under the provisions of

Deposit taking NBFC vide Registration no B-07-00791 dated May 25, 2023 with the Reserve Bank of India ('RBI'). 3. These financial results have been prepared in accordance with the Regulations 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended (the 'Listing Regulations') and recognition and measurement principles laid down in Indian Accounting Standards, notified under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended by the Companies (Indian Accounting Standards) Rules, 2016, other relevant

Companies Act, 1956. The Company is a non-banking financial company ('NBFC') registered as Non

provisions of the Act, guidelines issued by the RBI as applicable to NBFCs and other accounting principles generally accepted in India. 4. Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on November 9, 2023 and reviewed by joint statutory auditors, pursuant to Regulation 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as

5. The above is an extract of the detailed format of quarter and half year ended financial results filed with the National Stock Exchange under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the website of the stock exchange i.e. www.nseindia.com and on the website of the Company i.e. www.smfgindiacredit.com.

> For and on behalf of the Board of Directors of SMFG India Credit Co. Ltd. (Formerly Fullerton India Credit Co. Ltd.)

Sd/-

**Shantanu Mitra CEO & Managing Director** DIN: 03019468

Date: November 9, 2023

Ahmedabad

financialexp.epapr.in

ii After Extraordinary Items ((in ₹)

## ફાયનાન્સિયલ એક્સપ્રેસ

## શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ cin: L17239GJ1985PLC007829

**રજિસ્ટર્ડ એક્સિ:** હાર્મની, 4થો માળ, 15/એ, શ્રી વિદ્યાનગર કો. ઓપ. હાઉ. સો. લિ., નાબાર્ડની સામે, ઉસ્માનપુરા ગાર્ડન પાસે, અમદાવાદ – 380014 **• ટેલિકોન નં**.: 079-26565792

	મ્બર ૩૦, ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર		(ઇપીએસ સિવ	
		ત્રિમાસિક	વર્ષના	પાછલા વર્ષ
ક્રમ	વિગત	ગાળાના	અંતે	30.06.202
નં.	40111	30.06.2023	31.03.2023	માં અનુરૂપ ત્ર મહિના પૂરા થ
		અનઓડિટેડ	ઓડિટેડ	અનઓડિટે
٩	કામગીરીમાંથી કુલ આવક (નેટ)	<b>८७०</b> €.७४	33६3५.०६	૧૦૦૭૨.૧૯
ર	સમયગાળા માટે યોખ્ખો નક્ષે (કર પહેલાં, અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ)	૧૨૬૮.૭૨	४१०८.५१	૯૯૧.૫૦
3	કર પહેલાંના સમયગાળા માટે ચોખ્ખો નક્ષે, (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	<b>૧૨</b> ૬૮.૭૨	४१०८.५१	૯૯૧.૫૦
8	કર પછીના સમયગાળા માટે યોખ્ખો નફો (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	<b>૭</b> ૯૧.3૪	3905.25	૭૦૫.૦૦
ч	સમયગાળા માટે કુલ વ્યાપક આવક (કર પછી) અને અન્ય વ્યાપક આવક (કર પછી)	-	૩૦૨૪.૯૫	-
S	ઇક્વિટી શેર કેપિટલ	૮૭.૫૮	૮૭.૫૮	૮૭.૫૮
و	પાછલા વર્ષની બેલેન્સ શીટમાં બતાવ્યા પ્રમાણે અનામત (પુનઃમૂલ્યાંકન અનામત સિવાય)	-	₹٩₹33.60	
۷	ઇક્વિટી શેર મૂડીનું ફેસ વેલ્યુ	٩.٥٥	٩.٥٥	9.00
૯	શેર દીઠ કમાણી (અસાધારણ વસ્તુઓ પહેલાં અને પછી) મૂળભૂત / પાતળું:	6.08	38.48	८.०١

**નોંધ:** ઉપરોક્ત SEBI (લિસ્ટિંગ અને અન્ય ડિસ્ક્લોઝર જરૂરીયા તો) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમન 33 હેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાયેલ ત્રિમાસિક નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો એક અર્ક છે. ત્રિમાસિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ છે. સ્ટોક એક્સચેન્જ વેબસાઇટ એટલે કે www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.shrijagdamba.com. **શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ** 

રમાકાંત ભોજનગરવાલા (મેનેજિંગ ડિરેક્ટર) (ડીઆઈએન: ૦૦૦૧૨૭૩૩) તારીખઃ ૦૯.૧૧.૨૦૨૩ સ્થળઃ અમદાવાદ



રીજનલ ઓફિસ, અમદાવાદ : દ્યી સાઉથ ઈન્ડિયન બેંક લિં, રીજનલ ઓફિસ ઝમદાવાદ : ચોથો માળ, સા<del>કા</del>ર - VII, નેહરૂ બ્રીજ જંકશન, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૯, ફોન નં. ૦૯૯-૨૬૫૮૫૬૦૦, ૫૯૦૦ ઇમેલ : ro1018@sib.co.in

RO-AHM/0777/SH/SAR/SALE/68/2023-24, Date: 07.11.2023 પરિશિષ્ટ - ૪-એ (નિયમ ૮(૬)) સ્થાવર મિલકતોના વેચાણ માટે ટેન્ડર કમ હરાજી વેચાણ નોટીસ એકાઉન્ટ નં. મે. નિમા ફેશન (પ્રો. શ્રી મનોજ કનૈયાલાલ શર્મા), શાખા-મણીનગર

સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (અધિનિયમ) ૨૦૦૨ તથા સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઈ હેઠળ સ્થાવર મિલકતોનું હરાજીથી વેચાણની વેચાણ માટેની ટેન્ડર કમ ઓકશન વેચાણ નોટીસ.

આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઉધારકર્તા અને જામીનદારોને સૂચના આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકત દ્યી સાઉથ ઈન્ડિયન બેંક લિં. મણીનગર શાખ (મુકરર દેવાદારો) પાસે ગીરો / ચાર્જ કરેલ છે, જેનો પ્રત્<del>થક્ષ કબજો તા. ૨૯.૧૦.૨૦૨૩</del> ના રોજ **દી** સાઉથ ઇન્ડિયન બેંક લિમીટેડ, રીજનલ ઓફિસ, અમદાવાદ (મુકરર દેવાદાર) ના અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવી છે જે "<mark>જે જેમ છે ત્થાં છે" "જેમ છે તેમ" અને "જે ત્થાં છે તેમ</mark>" (સુરક્ષીત સંપત્તિઓનાં અસત્ય, પ્રકૃતિ અને ભૌતિક સ્થિતીમાં સંદર્ભે) વેચાણ કરવામાં આવશે. તા. ૧૬.૧૨.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યા (વેચાણની તારીખ) દી સાઉથ ઇન્ડિયન બેંક સિમીટેડ, મણીનગર શાખા, શીવદીપ બિલ્ડીંગ, બીઆરટીએસ સ્ટેન્ડની પાસે, મણીનગર રેલ્વે સ્ટેશનની સામે, મણીનગર, અમદાવાદ - ૩૮૦૦૦૮ (વેચાણનું સ્થળ) ની રકમની વસુલાત માટે ની રકમ રૂા. ૨,હ૮,૪૨,૨૦૫.૦૨ (રૂપિયા બે કરોડ ઇઠયોત્તેર લાખ બેતાલીસ હજાર બરસો પાંચ અને પૈસા બે પુરા) તા. ૦૬.૧૧.૨૦૨૩ સુધીના, બાકી લ્હેંજ્ઞી રકમને કારણે લોન એકાઉન્ટ મે. નિમા ફેશન (પ્રોપ્રાઈટર - શ્રી મનોજ કનૈયાલાલ શર્મા, શાખા - મણીનગર દ્રારા ઉધારકર્તાઓ પાસેથી ચડત વ્યાજ, કોસ્ટ અને ખર્ચાઓ (મુકરર દેવાદાર) સાથે **(૧). શ્રી મનોજ કનૈયાલાલ શર્મા (પ્રોપ્રાઇટર** : **મે. નિ**મા ફેશન), ૨૦૫, શીવદિપ એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પણ** : બી-૪૨, રાજરત્ના બંગ્લોઝ, ઘોડાસર, એમ.બી. પટેલ ફાર્ય હાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં** up: બી-૭૭. ઉપાસના રાજબાગ સોસાયટી, ધોડાસર કેનાલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૦ અને જામીનદારો : - (૨). શ્રીમતી સરોજબેન શર્મા @ સરોજદેવી શર્મા @ શર્મા શરોજદેવી કનૈયાલાલ, ૨૦૫, શીવદિપ એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પણ** : બી-૪૨, રાજરત્ના બંગ્લોઝ, ઘોડાસર, એમ.બી. પટેલ ફાર્મ હાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં પણ** : બી-૭૭, ઉપાસના રાજબાગ સોસાયટી, ઘોડાસર કેનાલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૦, (૩). શ્રીમતી **વિમળા શર્મા,** ૨૦૫, શીવદિપ એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પણ** : બી-૪૨ રાજરત્ના બંગ્લોઝ, ઘોડાસર, એમ.બી. પટેલ ફાર્મ હાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં** પણ : બી-૭૭, ઉપાસના રાજબાગ સોસાયટી, ઘોડાસર કેનાલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૦, ઝનામત કિંમત : રૂા. ૧,૩૧,૦૦,૦૦૦/- (અંકે રૂા. એક કરોડ એક્ઝીસ લાખ પુરા) અને અર્નેસ્ટ મની કિપોઝીટ : રૂા. ૧૩,૧૦,૦૦૦/- (અંકે રૂા. તેર લાખ દસ હજાર પુરા).

(મિલકતના માલિકનું નામ : શ્રી મનોજ કનૈયાલાલ શર્મા અને સરોજબેન શર્મા) મિલકતનું વર્શન : મનોજ કનૈયાલાલ શર્મા અને સરોજબેન શર્મા ની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૧૯૪.૮૨ સ્કે.મી. બિલ્ડીંગ સાથે, બી-૪૨, અન્ય તમામ બાંધકામો, સુધારાઓ તેના પર અસ્તિત્વમાં રહેલા અને અનુરૂપ સરળતાના અધિકારો સાથે, રાજરત્ન (ઘોડાસર) કો. ઓ. હાઉસીંગ સોસાયટી લિ. થી જાણીતો સ્કીમ, જે સ્થિત જમીનનો સર્વે નં. ૫૮, ૬૧, ૬૨ પૈકી, એફ.પી. નં. ૧૨૬, ટીપીએસ નં. ૪૫, એમ.બી. પટેલ ફાર્માની પાસે, ઘોડાસર ગામ, તાલુકો - સીટી, હવે મણીનગર, જીલ્લો - અમદાવાદ, વેચાણ ડીડ નં. **૬** ૬૦ €/૨૦૦ €, તા. ૦૪.૧૨.૨૦૦ €, સબ ૨જીસ્ટ્રાર ઓફિસ - અમદાવાદ - ૫ (નારોલ). <mark>ચતુઃસીમા ઃ- ઉત્તરે</mark> ઃ રોડ, દક્ષિ**શે** ઃ ફાઈનલ પ્લોટ નં. ૧૨૫ (ચંદન સોસાયટી), **પૂર્વે** ઃ રોડ, પશ્ચિમે : યુનિટ નં. બી-૪૧. (લેંકને જાણમાં લોજો : નથી)

. વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને સાઉથ ઈન્ડિયન બેંક લિમીટેડ (મુકરર દેવાદાર). વેબસાઈટ: www. southindianbank.com માં આપેલી લિંકનો સંદર્ભ લો.

ારીખ : ૦७.૧૧.૨૦૨૩

અધિકૃત અધિકારી, ઘી સાઉથ ઇન્ડિયન બેંક લિ



(b) Diluted

#### **EURO INDIA FRESH FOODS LIMITED**

(Formerly known as Euro India Fresh Foods Private Limited)
office: A-22/1, Ichhapore GIDC, Hazira-Magdala Road, Surat-394510, Gujarat, India. CIN: L15400GJ2009PLC057789. Email ID: investor@euroindiafoods.co

#### **Extract of Unaudited Financial Results for the** Quarter and Half Year ended September 30,2023

(Rs. in Lakhs, except EPS) Half Year Quarter Quarter **Particulars** ended on ended on ended on 30.9.2023 30.9.2023 30.9.2022 (Unaudited) (Unaudited) Unaudited Revenue from Operations 2689 5477 3693 2. Profit before Exceptional 82 126 45 Items and Tax 3. Profit before Tax 82 126 45 Profit for the period 82 126 45 **Total Comprehensive** 82 128 49 Income (after Tax) 6. Paid up Equity Share 2480 2480 2480 Capital (of Rs. 10 each) Earnings per Equity Share (a) Basic - Weightage 0.33 0.18 0.51

Reserves for the year ended March 31, 2023, were Rs. 3849 Lakhs Notes:

- 1) The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, is available on the website of the National Stock Exchange of India Limited at www.nseindia.com and the website of the Company at www.euroindiafoods.com.
- 2) The above Unaudited Standalone Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, were reviewed and recommended by the Audit Committee and subsequently approved by the Board of Directors at their Meeting held on Wednesday, November 08, 2023.
- 3) The Limited Review as required under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the Statutory Auditor of the Compa

For, EURO INDIA FRESH FOODS LIMITED

Place: Surat Javnika Gandharva Date: November 08, 2023 Company Secretary & Compliance Officer

#### કેમક્સ એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ

<mark>સી.આઇ.એન : એલ૦૧૧૧૦જીજે૧૯૯૬પીએલસી૦૨૯૩૨</mark>૯ રજિ.ઓફિસ: ૩૩૦, ટ્રિવિયા કોમ્પલેક્ષ, નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વડોદરા-<mark>૩૯</mark>૦૦૦૭

ઇ-મેલ: girishshah@chemcrux.com ફોન: ०२૬૫-२૯८४८०३/२૯८८૯०३

वेक्साधर: www.chemcrux.com ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વર્ષના અનઓડિટેડ સ્ટેન્ડઅલોન

	•	નાણાકીય પરિ	ણામોનો નિવ	દન	(રુપિયા લાખો	ાણી સિવાય)	
			કવાર્ટરના અ			ર્ાના અંતે	વર્ષના અંતે
ક્રમ	વિગતો	૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરના અંતે (અનઓડિટેડ)	૩૦મી જૂન ૨૦૨૩ ક્વાર્ટરના અંતે (અનઓડ્ટિટડ)	૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરના અંતે (અનઓડિટેડ)	૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ સમાપ્ત થયેલ અર્ધ વર્ષ અંતે (અનૉડિટેડ)	૨૦૨૨ સમાપ્ત થયેલ અર્ધ વર્ષ	૩૧/૦૩/૨૦૨૩ ( <b>ઑડિટેડ</b> )
٩.	કામગીરીથી કુલ આવક (નેટ)	1509.59	२,२४५.७७	२,८०५.४८	૩૮૫૪.૬૩	પપર૧.૦૫	૯૬૨૦.૪૫
٦.	સમયગાળા માટે ચોખ્ખો નફો/ નુકશાન કર પહેલા, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ)	192.31	315.11	૫૫૦.૯૭	४७४.४०	૧,૦૬૭.૭૫	१,૯۶४.७७
3.	સમયગાળા માટે ચોખ્ખો નફો/ નુકશાન કર પહેલા, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	192.31	315.11	૫૫૦.૯૭	४७४.४०	1,059.94	1,658.96
у.	(અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	૧૨૪.૪૪	232.52	૪૦૨.૫૭	૩૫૭.૦૫	૭૮૫.૬૨	૧,૪૩૫.૮૧
ч.	સમયગાળા માટે કુલ સમગ્રહલક્ષી આવક (તે સમય ગાળા માટે નકો/નુકશાનનો સમાવેશ કર પછી) અને અન્ય સમગ્રહલક્ષી આવક કર પછી		૨૫૮.૭૯	802.59	39८.२9	9 <b>૯</b> ૪.૧૦	૧,૪૬૮.૪૨
۶.	ઇકિવટી શેર મુડી (ફેસ વેલ્યુ રુ.૧૦/- પ્રતિ શેર)	1860.66	1860.66	1860.66	1860.66	1860.66	1860.66
9.	પુર્નમુલ્યાંકન અનામત સિવાયની અન્ય ઇકિવટી	-	-	-	-	-	૫૧૫૯.૭૦
۷.	શેરદીઠ કમાણી (દરેક રુ.૧૦/- ની ) ૧. મૂળભૂત (રુ. મા)	85.0	1.49	2.92	ર.૪૧	૫.૩૧	৫.৩০
	૨. ભળેલા (રુ. માં )	0.88	૧.૫૭	ર.૭૨	૨.૪૧	૫.૩૧	৫.৩০
	Yea.						

સ્થળ: વડોદરા

નાશાઃ ૧. ઉપરોક્ત અનઓક્ટિડ સ્ટેન્ડઅલોન નાષ્યાકીય પરિણામોની ઓડિટ સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ૦૯મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ યોજાયેલી તેમની સંબંધિત બેઠકોમાં મંજુર કરવામાં આવી છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધ વર્ષના આંકડાઓ વૈધાનિક ઓડિટર્સ દ્વારા મર્ચાદિત સમીક્ષાને આધિન છે. ૨. પાછલા વર્ષોના આંકડાઓ ફરીથી જૂથબદ્ધ કરવામાં આવ્યા છે અને જરુ-દી હોય ત્યાં પુનઃવર્ગીકરણ કરવામાં આવ્યા છે. ૩. ઉપરોક્ત સેબી (વિસ્ટિંગ અને અન્ય કિસ્તીઝર દિલાયદયેન્ટ્સ) રેગ્યુલા એક અને કર્યા હોય સ્ટાર્ક કર્યોલ ત્રિમાસિક અને અર્ય વાર્ષિક નાણાકીય પરિણામો નું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સયેન્જની વેબસાઇટ www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.chemcrux.com પર ઉપલબ્ધ છે.

બોર્ડના આદેશથી કેમકક્ષ એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ વતી સહી/- ગિરીશકુમાર શાહ (હૉલ ટાઈમ ડિરેક્ટર) તારીખ: ૦૯મી નવેમ્બર ૨૦૨૩

Chola योलामंडलम् र्यन्वेस्टमेन्ट येन्ड झार्यनान्स झंपनी लिमिटेड કોર્પોરેટ ઓફિસ : ચોલા ક્રેસ્ટ, સુપર બી, સીપ૪ અને સીપપ, ૪, થીરૂ વી કા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગિન્ડી, ચેન્નાઈ ૬૦૦૦૦૧

પરિશિષ્ટ ૪ [લુઓ નિયમ ૮(૧)] ક્લાજા નોટીસ (સ્થાવર મિલકત માટે) આથી <mark>ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડના</mark> અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરનાર, ધી સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્થોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ના ૫૪) અને સેક્શન ૧૩(૧૨)ને ધી સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાલે લેતાં હેઠળ મળેલ સત્તાની રૂએ દેણદાર ને એક ડિમાન્ડ નોટિસ મોકલી હતી નોટિસમાં જણાવેલ રકમ અને તેના પરનું વ્યાજ ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવેલ. દેણદાર આ તેને મળેલ સદર કાયદાના સેક્શનના સબ-સેક્શન (૪) સેકશન ૧૩ ને ધ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ હેઠળ

રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલ છે, જેથી દેશદારો અને જાહેર જનતાને આ નોટિસથી જજ્ઞાવવામાં આવે છે કે નીચે વર્ણવેલ મિલકતોનો નીચે સહી કરનારે મળેલ સત્તાની રૂએ <del>કબજો</del> લીધો છે. દેણદારને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે સૂચિમાં જણાવેલ મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ સોદા ધિરાણ અને તેના પરના વ્યાજે સાથે **મેસર્સ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્**ડ <del>ફાઈનાબ્સ કંપની લિમિટેડ</del>ના ચાર્જમાં ગણાશે. સિક્ચોર્ડ અસ્કચામતો છોડાવવાની ઉપલબ્ધતા સમયમર્યાદા અંગે સરફેસી કાયદાના સેક્શન ૧૩ના બ-સેક્શન (૮) તરફ દેણદારનું ધ્યાન દોરવામાં આવે છે.

દેશદારનું નામ અને સરનામું અને લોન એકાઉન્ટ નં.	કીમાન્ડ નોટીસની તારીખ	બા <del>કી</del> ૨ <del>ક</del> મ	કબજાવાળી મિલકતનું વર્ણન	વાકીખ કબજાની
Loan Alc Nos.XOHLMES00002095704 વિજયકુમાર રામમસાદ લોઢા સેજલબેન વિજયકુમાર લોઢા રામમસાદ રામસિંહ લોઢા બધા રહે છે : લોઢાવાસ, મુખ્યા ડાક, ધરાજપુર-૩૮૫૫૩૫. અહીં પણ : ૧૯ખી. ગુરૂ ગ્રીન સોસાયટી, ભોયણ રોડ, ડીસા, ભોયણ રોડ. ડીસા-૩૮૫૫૩૫	£\$0\$-\$0-9b	રૂા. ૨૯,૦૭,૦૪૩/- (અંકે રૂપિયા ઓગણત્રીસ લાખ સાત હજાર ત્રેતાલીસ પુરા)	મિલકતનો તમામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં. ૧૯ પી, ના સર્વે નં. પ/૧, ભોયમ સીમ, તા.ડીસા, જીલ્લો બનાસકાંઠા, જેનું ક્ષેત્રફળ ૭૮.૩૭૫ ચો.મી. પ્લોટ નં. ૧૯પી, ગુરૂ ગ્રીન સોસાયીટી, ભોયણ રોડ, તા. ડીસા, જી. બનાસકાંઠા	
Loan A/c Nos. X0HLMES00002359170 બાભુભાઈ કાલુભાઈ નાઈ ગીતાબેન બાભુભાઈ નાઈ બધા રહે છે : હરીજન વાસબુરલ, ખીમત, બનાસકાંઠા, ડીસા -૩૮૫૫૪૫ અહીં પણ : પ્લીટ નં. ૧૨૦ ગુરૂ ગ્રીન સોસાયર્ટ ભોયણ રોડ, ડીસા, ભોયણ રોડ. ડીસા-૩૮૫૫૩૫	58-03-50-88	(અંકે રૂપિયા સત્યાવીસ લાખ	મિલકતનો તમામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં. ૧૨૦ સર્વે નં. ૫/૧, ભોયણ સીમ, તા.ડીસા, જીલ્લો બનાસકાંઠા, જેનું ક્ષેત્રફળ ૮૬.પ૧ ચો.મી. સીમાઓ સાથે.	
dl. : 04-99-6053			અધિકૃત અધિકારી,	
સ્થળ : ડીસા			મેસર્સ ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની	લિમિટેડ

#### ₹a**ı**rna

#### RATNABHUMI DEVELOPERS LIMITED

CIN: L45200GJ2006PLC048776

Regd. Office: Ratna Corporate House, Near Santoor Bungalows, Ambli, Daskroi, Ahmedabad-380058, Gujarat, India Contact No:+91 87585 51175; | Email:cs@ratnagroup.co.in; | Website: www.ratnagroup.co.in;

## EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30™ SEPTEMBER, 2023

			1.		
Sr. No.	Particulars	Quarter ended 30-09-2023 (Unaudited)	Quarter ended 30-09-2022 (Unaudited)	Half year ended 30-09-2023 (Unaudited)	Year Ended 31-03-2023 (Audited)
1	Total Income from Operations	22.47	6.36	33.34	21.63
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4.87	(14.89)	2.69	(21.73)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	4.87	(14.89)	2.69	(21.73)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	5.45	(14.88)	1.88	(21.08)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	6.08	11.40	6.24	23.38
6	Equity Share Capital	1370.00	1370.00	1370.00	1370.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	2107.32
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) –  1. Basic: 2. Diluted:	0.04 0.04	0.08 0.08	0.05 0.05	0.17 0.17

Note: a) The above is an extract of the detailed format of Quarterly and Half yearly Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and half yearly Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchange at www.bseindia.com and the company at www.ratnagroup.co.in.

b) The Turnover for the Quarter ended 30th September, 2023 is ₹ 29.24 lakhs, Profit before tax is ₹ 5.53 lakhs and Profit after Tax is ₹ 6.11 lakhs on stand-alone basis. For, Ratnabhumi Developers Limited

Su/-Kaivan Shah Chairman and Managing Director DIN: 01887130



Place: Ahmedabad

Date: 09-11-2023

### VADILAL CHEMICALS LIMITED

Regd. Office: 9TH Floor, Colonnade Building, Opp. Isocn Temple BRTS Bus stop, Ambli-Bopal Road, Ahmedabad-380054.,

#### CIN: L24231GJ1991PLC015390, EMAIL ID: info.vcl@vadilalgroup.com **EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS**

FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30-09-2023								
	(Rs	s. In Lacs exce	pt per share data)					
Particulars	Quarter ended on 30-09-2023	Current Year cumulative upto 30-09-2023 (6 months)	Corresponding three months ended on 30-09-2022 in the previous year					
	(Unaudited)	(Unaudited)	(Unaudited)					
Total income from operations (net)	2275.54	4190.57	2107.21					
Net Profit for the Period before tax,								
Exceptional Items/ Extraordinary Items	158.20	278.55	112.63					
Net Profit for the period before tax	158.20	278.55	112.63					
Net Profit for the period after tax	118.02	207.92	81.41					
Total Comprehensive Income for the Period	115.02	204.34	79.58					
Equity Share Capital	487.40	487.40	487.40					
Earnings Per Share (of Rs. 10 each)								
Basic :	2.42	4.27	1.67					
Diluted:	2.42	4.27	1.67					

#### Notes

- 1) The above is an extract of the detailed format of Unaudited Financial Results of the Company for the quarter and half year ended on 30-09-2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the guarter and half year ended on 30-09-2023 are available on Company's website viz www.vadilalchemi-
- The above Unaudited Financial results have been approved by the Board of Directors at its Board Meeting held on 9th November, 2023 and Limited Review of the above results have been carried out by statutory auditor of the company.

FOR VADILAL CHEMICALS LIMITED

Date: 9th November, 2023 **DEVANSHU L. GANDHI** Place: Ahmedabad DIRECTOR

#### DISHMAN CARBOGEN AMCIS LIMITED

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half Year ended 30-09-2023

CIN: L74900GJ2007PLC051338 Email ID: grievance@imdcal.com Web: www.imdcal.com
Dishman Corporate House, Iscon - Bopal Road, Ambli, Ahmedabad 380 058 Phone No: 02717- 420102/124

ı	(Hupees in Crores / In Ien Mi						
Sr. No.	Particulars	For The Quarter ended 30-09-2023	For The Preceding Quarter ended 30-06-2023	For The Corresponding Quarter ended 30-09-2022	For The Half Year ended 30-09-2023	For The Corresponding Half Year ended 30-09-2022	For The Year ended 31-03-2023
ш		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from operations (net)	586.59	723.38	613.96	1,309.97	1,154.57	2,412.92
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(33.21)	29.49	(12.29)	(3.72)	(12.59)	(6.44)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(36.26)	29.49	(12.29)	(6.77)	(12.59)	(54.59)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(40.90)	17.00	(10.05)	(23.90)	(6.04)	(29.80)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(96.52)	57.70	23.41	(38.82)	5.06	260.74
6	Equity Share Capital	31.36	31.36	31.36	31.36	31.36	31.36
7	Reserves (excluding revaluation reserve)	-	-	-	-	-	5,778.31
8	Securities Premium Account	-	-	-		-	4,738.76
9	Net worth	-	-	-	5,770.83	-	5,809.67
10	Paid up Debt Capital/ Outstanding Debt	-	-	-	1,950.60	-	1,824.51
11	Outstanding Redeemable Preference Shares	NA	NA	NA	NA	NA	NA
12	Debt Equity Ratio (Number of times)	0.34	0.34	-	0.34	-	0.31
13	Earnings Per Share (of Rs.2/- each) (for continuing and discontinued operations) -						
	Basic	(2.61)	1.08	(0.64)	(1.52)	(0.39)	(1.90)
	Diluted	(2.61)	1.08	(0.64)	(1.52)	(0.39)	(1.90)
14	Capital Redemption Reserve	-	-	-	-	-	-
15	Debenture Redemption Reserve	-	-	-	-	-	-
16	Debt Service Coverage Ratio	2.38	2.33	-	2.38	-	2.67
17	Interest Service Coverage Ratio	4.29	4.26	-	4.29	-	5.10
_							

F - Exceptional and/ or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules/ AS Rules, whichever is applicable

- For the other line items referred in regulation 52(4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 (\*Listing Regulation pertinent disclosures have been made to the Stock Exchange(s) BSE Limited and National Stock Exchange of India Limited and can be accessed
- www.bseindia.com, and www.nseindia.com. The impact on net profit/ loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclose
- The Financial results (standalone and consolidated) have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at the meetings held on 8th November, 2023. These financial results (standalone and consolidated) have been prepared in compliance with Ind AS as notified by the Ministry of Corporate Affairs and prescribed under Section 133 of the Companies Act, 2013, read with relevant rules issued thereunder and other

accounting pronouncements generally accepted in India, to the extent applicable.

The specified items of the standalone financial results of the company are given below;

Sr. No.	Particulars	For The Quarter ended 30-09-2023	For The Preceding Quarter ended 30-06-2023	For The Corresponding Quarter ended 30-09-2022	For The Half Year ended 30-09-2023	For The Corresponding Half Year ended 30-09-2022	For The Year ended 31-03-2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
i	Turnover	59.72	69.55	106.54	129.27	211.02	402.55
ii	Profit/(Loss) before tax	(9.26)	(33.03)	(26.79)	(42.29)	(66.48)	(96.20)
iii	Net Profit/(Loss) after tax	(5.78)	(21.33)	(17.28)	(27.11)	(42.11)	(58.87)
iν	Total Comprehensive Income (After Tax)	(3.45)	(15.08)	(35.15)	(18.53)	(73.96)	(117.48)

The previous quarter / year figures have been re-grouped, re-cast and re-arranged wherever considered necessary to make it comparable The above is an extract of the detailed format of the standalone and consolidated financial results for the quarter and half year ended September 30, 202: filed with the Stock Exchanges under Regulations 33 and 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 ("Listing and Other Disclosure Regulations"). Regulations"). The full format of the standalone and consolidated financial results for the quarter and half year ended Sentember 30, 2023, are available of the Stock Exchanges websites www.bseindia.com, and www.nseindia.com and on the Company's website www.imdcal.com.

For and on behalf of the board

Arpit J. Vyas Date: 8th November, 2023

Global Managing Director DIN: 01540057

(Rupees in Crores / in Ten Milli

#### adani Renewables

## અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ

#### એક્સ્ટ્રા ઓર્ડીનરી જનરલ મિટિંગની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે , અદાણી ગ્રીન એનર્જુ લિમિટેડના સભ્યોની એક્સ્ટ્રા ઓર્ડીનરી જનરલ મિટિંગ (ઇજીએમ) મંગળવાર, ૫મી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી) / અન્થ ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા ચોજાશે, જેમાં ઇજીએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના બિઝનેસ હાથ ધરાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેર્સનાં પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ , તા. ૮મી એપ્રિલ , ૨૦૨૦ , પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩મી જાન્યુઆરી , ૨૦૨૧ અને પરિપત્ર નં. ૨૧/૨૦૨૧ તા. ૧૪મી ડિસેમ્બર, ૨૦૨૧ અને SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 અને SEBI/HO/CFD/CMD2/CIR/P/2020/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ (૫રિપત્રો) ને ધ્યાનમાં રાખતા, વ્યક્તિગત હાજરી વગર ચોજાશે.

૫રિપત્રોને અંતર્ગત ૫મી ડિસેમ્બ૨, ૨૦૨૩ ના રોજ ચોજાનાર ઇજીએમની નોટિસ, જે સભ્યોના ઇમેલ કંપની અથવા ડિપોઝીટરી પાસે નોંધાચેલ છે, તેઓને મોક્લવામાં આવેલ છે. પરિપત્રો અંતર્ગત છાપેલ નોટિસ મોકલવાની જરૂરીયાત મોક્ફ રાખવામાં છે. ઇજીએમ બોલાવવા માટેની નોટિસ, કંપનીની વેબસાઇટ www.adanigreenenergy.com તથા નેશનલ સિક્ચોરિટીસ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ)ની વેબસાઇટ www.evoting.nsdl.com ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

કંપનીઝ એક્ટની ક્લમ ૧૦૮ની જોગવાઇઓ તથા સુધારા સહિતના કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના નિયમ ૨૦ તેમજ સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર્સ રિક્વાયરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ના નિયમન ૪૪ અન્વયે, ઇજીએમની નોટિસમાં વર્ણવવામાં આવેલા તમામ ઠરાવો ઉપર સભ્યોને તેમનો મત ઇલેક્ટ્રોન્કલી આપવા માટે ઇ-વોટિંગની સુવિધા નેશનલ સિક્ચોરિટી ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) મારફતે પુરી પાડવામાં આવેલ છે. મતના અધિકારો શુક્રવાર, 3જી નવેમ્બર, ૨૦૨૩ રોજની સ્થિતિ મુજબ રહેલા શેર્સની સંખ્યાના આદારે પ્રમાણસર ગણાશે, કે જે કટ-ઓફ તારીખ છે.

જો કોઇ સભ્ય એ ઇ-મેલ નોંધણી કરાવેલ નથી, તો નીચે દર્શવિલ સુચના અનુસાર લોગ-ઇનની વિગતો મેળવી શકે છે.

- અ. ફિઝીક્લ શેર ધરાવતા સભ્યો માટે જરૂરી વિગતો જેમ કે ફોલિઓ નં., શેરધારકનું નામ, શેર સર્ટિફિકેટની સ્કેલ કોપી (આગળ અને પાછળ), પાન (સ્વ. પ્રમાણિત પાનકાર્ડ ની કોપી), આધાર (સ્વ. પ્રમાણિત આધાર કાર્ડની કોપી) કંપનીના ઇ-મેલ investor.agel@adani.com ઉપર મોક્લવા.
- Demat માં શેર ધરાવતા શેર ધારકો જે-તે ડિપોઝીટ પાર્ટિસીપન્ટ પાસે ઇ-મેલ નોંધણી કરાવી શકે છે અથવા investor.agel@adani.com ઉપર DPID-client ID, નામ, Client Master, સ્વપ્રમાણિત પાન તથા આધારની કોપી મોકલાવી કરાવી શકે છે.

ડિમેટ અથવા ફિઝીક્લ શેર ધારકો પોતાનો વોટ ઇલેક્ટ્રોનીક્લ આપી શકે છે. સભ્યોને એ પણ જણાવવામાં આવે છે કે,

- નોટિસમાં વર્ણવવામાં આવેલ તમામ બિઝનેસ, ઇલેક્ટ્રોનીક વોટિંગ દ્વારા જ હાથ ધરવામાં
- રિમોટ ઇ-વોટિંગ શુક્રવાર ૧લી ડિસેમ્બર, ૨૦૨૩ના સવારે ૯:૦૦ વાગે શરૂ થશે.
- રીમોટ ઇ-વોટિંગ સોમવાર ૪થી ડિસેમ્બર, ૨૦૨૩ના સાંજે ૫:૦૦ વાગે પૂર્ણ થશે.
- જે વ્યક્તિ નોટિસ મોકલ્યા પછી સભ્ય બને છે અને કટ ઓફ્ના દિવસે શેર્સ ધરાવે છે, તેઓ evoting@nsdl.com અથવા investo.agel@adani.com ઉપર મેલ કરીને લોગ ઇન તથા પાસવર્ડ મેળવી શકે છે. અગર, જો તેઓ પહેલેથી નોંધાચેલ છે, તો હાલના લોગ ઇન અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.
- ઉપર દર્શાવેલ સમય પૂર્ણ થતા એનએસડીએલ દ્વારા વોટિંગ બંધ કરી દેવામાં આવશે અને તે બાદ સભ્યો ઇલેક્ટ્રોનીક વોટ કરી શકશે નહી.
- એફ. એક વાર Resolution પર વોટ કર્ચા પછી , તેઓ હેરફાર કરી શકશે નહીં.
- જે સભ્યોએ રિમોટ-ઇ-વોટિંગ કરેલ છે, તેઓ ઇજીએમમાં હાજર રહી શકે છે, પરંતુ ઇજીએમ દરમ્યાન વોટ કરી શકશે નહીં.
- એચ. જે સભ્યોએ પહેલેથી વોટ કરેલ નથી અને ઇજીએમમાં હાજર છે, તેઓ ઇજીએમમાં ઇ-વોટિંગ દ્વારા વોટ આપી શકે છે.

ઇ-વોટિંગ માટે જો આપના કોઇ સવાલ હોય તો સભ્યો તે માટે www.evoting.nsdl.com ઉપર હેલ્થ એક્શનમાં (ફિક્વન્ટલી આસ્કડ ક્વેશ્વન્સ - FAQs) (અવારનવાર પુછાતા પ્રશ્નો) અને ઇ-વોટિંગ મેન્યુઅલનો ઉપયોગ કરી શકે છે અથવા evoting@nsdl.co.in પર ઇ-મેઇલ કરી શકે છે અથવા ટોલ ફ્રી નંબર: ૧૮૦૦-૧૦૨૦-૯૯૦ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે. ઇ-વોટિંગને લગતી કોઇ પણ ફરિયાદ હોય તો , સરીતા મોટે , નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝટરી લિમિટેડ , ટ્રેડ વર્લ્ડ , એ-વિંગ , ચોથો માળ , કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાયટ માર્ગ, લોવર પરેલ (પૂર્વ), મુંબઇ - ૪૦૦૦૨૩ નો સંપર્ક ઇ-મેલઃ evoting@nsdl.co.in પર અથવા ઉપરોક્ત ટોલ ક્રી નંબર ઉપર કરી શકાશે.

ઇજીએમને લગતી માહિતી કંપનીની વેબસાઇટ www.adanigreenenergy.com એમએસડીએલની વેબસાઇટ evoting@nsdl.com તથા સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com તથા www.nseindia.com ઉપર પણ ઉપલબ્ધ છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વતી,

સ્થળ: અમદાવાદ

પ્રફ્રોશ દરજી

તારીખઃ ૦૯-૧૧-૨૦૨૩ **રજીસ્ટર્ડ ઓફિસઃ** "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત. ફોનઃ +૯૧-૭૯-૨૬૫૬ ૫૫૫૫ | ફેક્સઃ +૯૧-૭૯-૨૫૫૫ ૫૫૦૦ વેબસાઈટ: www.adanigreenenergy.com | સીઆઈએન: L40106GJ2015PLC082007